

પરીક્ષાર્થીઓ માટેની સૂચના

વર્તમાન પરીસ્થિતિને ધ્યાને રાખી યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે સત્રાંત પરીક્ષાને ઓફલાઈનને બદલે ઓનલાઈન લેવાનો નિર્ણય કરેલ છે.

- જેમાં નીચે મુજબની માર્ગદર્શક સૂચનાઓનો સમાવેશ થાય છે.
1. સત્રાંત પરીક્ષા લેખિતને બદલે મૌખિક અભિવ્યક્તિ સ્વરૂપે લેવી.
 2. મૌખિક અભિવ્યક્તિના મૂલ્યાંકન હેતુ ઓનલાઈન માધ્યમ (ગૂગલ મીટ)ની પસંદગી કરવી.
 3. પેપરનું નિયત થયેલ યુનિટ અનુસાર 70 કે 35 ગુણાંકન માળખું યથાવત રાખવું.
 4. 70 ગુણ મૂલ્યાંકન માટે 30 મિનિટ અને 35 ગુણ મૂલ્યાંકન માટે 15 મિનિટ ફાળવવી.
 5. બે પરીક્ષકો મૂલ્યાંકન કરશે.
 6. કોઈ એક દિવસ એક જ વિષયની પરીક્ષા રાખવી.
 7. પરીક્ષાર્થીને પુનઃચકાસણીની તક આપવી.

પરીક્ષાનું સ્વરૂપ :

- ઓનલાઈન મોડથી યોજાશે.
- 70 ગુણના પ્રશ્નપત્ર માટે 30 મિનિટ અને 35 ગુણના પ્રશ્નપત્ર માટે 15 મિનિટ ફાળવવામાં આવશે.
- યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર મુજબ સમયપત્રક જાહેર કરવામાં આવશે.

બેચ :

- યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર અનુસાર વિવિધ બેચ નિર્ધારિત કરવામાં આવશે, જે વિવિધ કોલેજોના પરીક્ષાર્થીઓની બનેલી હશે.
- પરીક્ષાર્થીએ પોતે કઈ બેચમાં છે તે સૌ પ્રથમ ચકાસી લેવું.
- બેચ અનુસાર તારીખ અને સમય યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવશે તે વેબસાઈટ/ERP માંથી પરીક્ષાર્થી મેળવી શકશે.
- નિર્ધારિત સમયપત્રક અને વિષય અનુસાર પરીક્ષાર્થીએ ઓનલાઈન ગૂગલ મીટના માધ્યમથી પરીક્ષા માટે જોડાવાનું રહેશે.

પૂર્વ તૈયારી :

- પરીક્ષાર્થીએ ગૂગલ મીટ લીન્કમાં જોડાતાં પહેલાં ટેકનિકલ બાબતો ચકાસી લેવી, જેથી લોગઈન થવામાં અને પરીક્ષા આપવામાં મુશ્કેલી ના આવે.
- નિર્ધારિત સમયાનુસાર નિયત બેચની જ લીન્કમાં જોડાવાનું રહેશે.



॥ न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ॥

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન

Indian Institute of Teacher Education

(A State Public University established by Government of Gujarat)

- પરીક્ષાર્થીઓએ પોતાની કોલેજનું ઓળખપત્ર તથા હોલ ટીકીટ સાથે રાખવી જે પરીક્ષા શરુ થતા પહેલા પરીક્ષકોને બતાવવાની થશે.
- પરીક્ષા દરમ્યાન આકૃતિ/ આવેખ/ ગણતરી દર્શાવવા કે લખવા જરૂરી માત્રામાં કોરા કાગળ અને પેન / પેન્સિલ રાખવા. એ સિવાયનું કોઈ સાહિત્ય રાખવું નહીં.
- પરીક્ષા દરમ્યાનની કોઇપણ પ્રકારની ગેરરીતિના કિસ્સામાં પરીક્ષક/ યુનિવર્સિટી તરફથી શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

પરીક્ષા પ્રક્રિયા:

- યુનિવર્સિટી તરફથી દરેક પરીક્ષાર્થીના મૂલ્યાંકન માટે બે પરીક્ષકની નિયુક્તિ કરવામાં આવશે.
- પરીક્ષકો દરેક પરીક્ષાર્થીની 70 ગુણ માટે 30 મિનિટ અને 35 ગુણ માટે 15 મિનિટ પરીક્ષા લેશે.
- પરીક્ષાર્થીનું ગુણાંકન 70 ગુણના કિસ્સામાં 14+14+14+14+14 એમ યુનિટ દીઠ 14 ગુણ પ્રમાણે 4 યુનિટના 56 ગુણ ચાર પ્રશ્નો પ્રમાણે તથા પાંચમા પ્રશ્નમાં સર્વગ્રાહી રજૂઆતના 14 ગુણ પ્રમાણે કુલ 70 ગુણનું પરીક્ષકો ગુણાંકન કરશે.
- પરીક્ષાર્થી પસંદગીનો યુનિટ પરીક્ષકને જણાવી શકશે જેથી તે ક્રમ મુજબ પ્રશ્નો પૂછી શકાય.
- પ્રત્યેક યુનિટની 10 જેટલી બાબતો પૈકી પરીક્ષક મહત્તમ છ પ્રશ્નો પૂછશે. જે પૈકી 3 પ્રશ્નોના જવાબના આધારે 14 ગુણમાંથી ગુણાંકન થશે. આ ગુણાંકનમાં વિષય વસ્તુની સુસંગતતા, રજૂઆતની સુગ્રથિતા, ભાષાની શુદ્ધતા, ઉત્તરની યોગ્ય લંબાઈ જેવી બાબતો ધ્યાને લેવામાં આવશે.
- પરીક્ષાર્થીના પ્રત્યુત્તરનાં આધારે સમગ્ર ચકાસણી માટે પરીક્ષક પેટા પ્રશ્નો પૂછી શકશે.
- આ સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવનાર છે.
- જો કોઈ પરીક્ષાર્થીને પરિણામ જાહેર થયા બાદ કોઈ પ્રશ્નપત્રના મૂલ્યાંકનમાં અસંતોષ જણાય તો તે રીચેકીંગ (પુન:ચકાસણી) હેતુ નિયત સમયમર્યાદામાં નિયત ફી ભરી અરજી કરી શકશે.




(Signature)

પરીક્ષા નિયામકશ્રી

રામકૃષ્ણ પરમહંસ વિદ્યા સંકુલ, મહાત્મા મંદિર પાસે, ખ રોડ, સેક્ટર-૧૫, ગાંધીનગર, ગુજરાત - ૩૮૨૦૧૬

Ramkrushna Paramhans Vidhya Sankul, Nr. Mahatma Mandir, Kh-Road, Sector-15, Gandhinagar-382016, Gujarat, India

Fax: 079-23288016, Phone: +91-79-23287338, 23243733/34

Email: contact@iite.ac.in, Web :www.iite.ac.in    YouTube iitegandhinagar